

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨/૧/૨૦૧૭ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૦૮/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૭ કેસ કરી, ૪૫ વ્યક્તિઓને ઝડપી, ૨૩ લીટર દેશી દારૂ, ૪૫ બોટલ ઇંગ્લીશ દારૂ, ૪૯ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ અને ૭૬ બીયર ટીન કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૦૧ કેસ કરી ૦૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૭,૯૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૦૯/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૧૦/૧૭

સોલા હાઇકોર્ટ: કેતનભાઈ મધુસુદન પરીખ (ઉ.વ.૫૩)(રહે,બંગલા નંબર-૧૦, શિવ ગણેશ બંગ્લોઝ-૨, સોમેશ્વર મહાદેવનાં મંદિર નજીક હેબતપુર રોડ થલતેજ) એ તા.૨/૧/૧૭ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૦/૧૨/૧૬ કલાક ૨/૩૦ થી તા.૨/૧/૧૭ કલાક ૩/૩૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી પેનાસોનીક કંપનીનું એલ.ઇ.ડી.ટી.વી, સોનાનાં દાગીના, કાંડા ઘડીયાળ અને બ્રીસલેટ મળી કુલ કિંમત રૂપિયા ૯,૭૩,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી ડી.વી.રાણા ચલાવે છે.

સોનાનો દોરો ખેંચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૧૧/૧૭

વેજલપુર: માલતીબહેન વા/ઓ રમેશભાઈ જોશી (ઉ.વ.૫૮)(રહે.હરીહરાનંદ સોસાયટી, મલાવ તળાવ રોડ, રજવાડુ હોટલની બાજુમા જીવરાજપાર્ક) તા.૧/૧/૧૭ બપોરના ૧/૪૫ વાગ્યાનાં સુમારે પોતાની સોસાયટીના ગલીના નાકેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ (૨૫ થી ૩૦ વર્ષ આશરના) બે પુરૂષ માલતીબહેનના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૮૦,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ માલતીબહેન જોશીએ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.બી.કોડીયાતર ચલાવે છે.

દાઝી જતાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૧૨/૧૭

કૃષ્ણનગર: નલીનભાઈ ઉતમચંદ શાહ (ઉ.વ.૫૬)(રહે, ગુજરાત હાઉસીંગ બોર્ડ કૃષ્ણનગર) તા.૪/૧૨/૧૬ કલાક ૧૧/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પ્રાયમસમાં કેરોસીન પુરી દીવાસળી પેટાવતા ભડકો થતા દાઝી ગયા હતા. સારવાર માટે તેમને રૂદ્રાક્ષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧/૧/૧૭ બપોરનાં ૨/૩૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી જે.કે.રાઠોડ ચલાવે છે.

દાણીલીમડા: ફરજાનાબાનુ વા/ઓ શફુદ્દીન શેખ (ઉ.વ.૩૦)(રહે,શક્તિ સોસાયટી દાણીલીમડા) તા.૨૨/૧૨/૧૬ કલાક ૧૦/૦૦ વાગ્યાનાં સુમારે પોતાના ઘરે પ્રાઇમસ ઉપર નાસ્તો બનાવતા હતા ત્યારે પ્રાયમસમાં ભડકો થતાં ફરજાનાબાનુ દાઝી ગયા હતા. સારવાર માટે તેમને વા.સા.હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૩૧/૧૨/૧૬ રાતના ૧૦/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ હે.કો.શ્રી કાન્તીભાઈ પુંજાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.